

CREDAI SURAT

Confederation of Real Estate Developers Association of India - Surat

**Office Bearers :
2019 - 2021**

Ref. No. : CREDAI / SRT / F.40 / 59 / 2021

Date : 02/06/2021

Chairman

Suresh Patel

98250 95858

gruha2002@yahoo.com

President

Ravjibhai Patel

99252 05961

Vice-President

Alpeshbhai Kotadia

98251 13861

Sanjay Mangukhiya

98251 22383

Dr. Jignesh Patel

93755 44000

Secretary

Vijay Dhamelia

98258 00402

vijaydhamelia_2004@yahoo.com

Jt. Secretary

Amar Raval

98251 26001

Dipan Desai

98241 14798

Tushar Lakhani

98259 05444

Treasurer

Bhavesh Sanghavi

98251 20206

Jt. Treasurer

Peenal Thakkar

98251 38788

Chief Co-Ordinator

Harshil Deliwala

98251 40401

Zonal Co-Ordinators

Rajesh Ravani

98251 45122

Amit Sangani

99250 00679

Haresh Motisariya

98243 55311

Nihar Patel

78788 83222

Ritesh Kheni

98251 41600

Maganbhai Dobariya

98255 65665

Hitesh Sakariya

98253 48686

પ્રતિ,

પ્રમુખશ્રી, ક્રેડાઈ-ગુજરાત

બી/૮૦૧-૮૦૨, સોલીટર કોર્પોરેટ પાર્ક,

દિવ્ય ભાસ્કર પાસે, એસ.જી. હાઈ-વે,

અમદાવાદ - ૩૮૦૦૫૧

વિષય: યુનિયન બજેટ-૨૦૨૧ માં “ વન ટાઈમ સેટલમેન્ટ ” ની રદ કરેલ
જોગવાઈ પુનઃ ચાલુ કરાવવા અંગે...

મહેરબાન સાહેબશ્રી,

ઉપરોક્ત વિષય અન્વયે આપશ્રીને નિવેદન કરવાનું કે, ઇન્કમેટેક્સ સેટલમેન્ટ કમિશન એ આવકવેરા કાયદા હેઠળ સ્થાપિત ભારતમાં એક પ્રીમિયર વૈકલ્પિક તકરાર ઠરાવ (એડીઆર) એટલે કે અર્ધ-ન્યાયિક સંસ્થા છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી કે. એન. વંચુની અધ્યક્ષતામાં ડાયરેક્ટ ટેક્સ ઇન્કવાયરી સમિતિની ભલામણ પર વર્ષ ૧૯૭૬ માં ઇન્કમેટેક્સ સેટલમેન્ટ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. તેમની કમિટીએ સેટલમેન્ટ કમિશનની કલ્પના કરી હતી કે “એક વખતના કર માંથી છૂટકારો અથવા અનિશ્ચિત ડિફોલ્ટરને તેની બાબતોમાં સ્વચ્છ બનાવવાની મંજૂરી આપવામાં આવે.”

આવકવેરા કાયદા, ૧૯૬૧ ના ચેપ્ટર XIX - A માં કેસોના સમાધાન માટેની જોગવાઈ છે. ITSC નો પ્રાથમિક ઉદ્દેશ એ છે કે, ભૂલ એ કરદાતા માટે કાયમી ધોરણે સમાધાન માટેનો દરવાજો બંધ થવો જોઈએ નહીં. ITSC ની સ્થાપનાનો હેતુ જ એ હતો કે અનંત અને લાંબા સમય સુધી ચાલતા મુકદ્દમાને ટાળીને, જટિલ કેસોમાં કરની જવાબદારીઓને સમાધાન કરવાનો છે. બંને વિવાદ કરનાર પક્ષો, એક તરફ આવકવેરા વિભાગ અને બીજી બાજુ કરદાતાને કાયદેસર ઠરાવીને ભારતીય આવકવેરા અને વેલ્થ ટેક્સ કાયદાના સંદર્ભમાં કરના વિવાદોનું સમાધાન કરવું.


કાર્યવાહીના કોઈપણ તબક્કે કરદાતા સાથે સમાધાન માટેની કાયદામાં જોગવાઈ હોવી જોઈએ જે ન્યાયિક દ્રષ્ટિએ યોગ્ય જણાય છે. સમાધાન એ એક ખ્યાલ છે જે ભારત સિવાયના દેશોએ પણ તેનો સ્વીકાર કર્યો છે અને તે પદ્ધતિ અમલમાં છે. જેમ કે, યુનાઈટેડ કિંગડમમાં, કબૂલાત પદ્ધતિ ૧૯૨૩ થી પ્રચલિત છે અને યુ.એસ. નાં કાયદામાં પણ કરદાતા સાથે કરવેરાની જવાબદારીઓ અંગે સમાધાન કરવાની જોગવાઈ છે. યુનાઈટેડ કિંગડમ આઈઆરએસમાં કબૂલાતની Hansard પ્રક્રિયા અને યુ.એસ. આઈઆરએસની સમાધાન પ્રક્રિયા વગેરે.

ઇન્કમેટેક્સ સેટલમેન્ટ કમિશનની કાર્યવાહીથી ડીપાર્ટમેન્ટ અને એસેસી બંનેને માટે ફાયદાકારક હતા અને છે. કારણ કે વધારાની આવક પરનો કર અને વ્યાજ ITSC માં અરજી ફાઇલ કરતાં પહેલાં સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવતી હતી. અને અરજદાર સંપૂર્ણ અને સાચી જાહેરાત કરે છે એટલે ડીપાર્ટમેન્ટના ખર્ચ અને સરકારી કાર્યમાં નોંધપાત્ર ઘટાડો થતો હતો.


ફાઇનાન્સ બિલ, ૨૦૨૧ માં કરદાતાન ખુબ જ અન્યાય કરતો સુધારો કરવામાં આવ્યો છે કે આવકવેરા સમાધાન પંચ (ITSC) ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ અથવા તે પછી આ જોગવાઈ બંધ કરશે. આનો અર્થ એ છે કે કેસોના સમાધાન માટે ઇનકમ ટેક્સ એક્ટ-૧૯૬૧ ની કલમ ૨૪૫-સી હેઠળ કોઈ અરજી ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ અથવા તે પછી સ્વીકારવામાં આવશે નહીં. ઇન્કમ-ટેક્સ સેટલમેન્ટ કમિશન (ITSC) બંધ કરવાનો અને પેનલિંગ કેસો માટે વચગાળાના બોર્ડ ઓફ સેટલમેન્ટની રચના કરવાની દરખાસ્ત છે.

આ જોગવાઈ બંધ કરવાથી માનવી/વ્યક્તિને પોતાની ઉપર આવી પડેલ જવાબદારીમાંથી જીંદગીમાં એક સમય સમાધાનનો અધિકાર હોવો જોઈએ. તેથી ઉપરોક્ત જોગવાઈ ફરી દાખલ કરવા વિનંતિ છે.


લિ. આપના વિશ્વાસુ



સુરેશ પટેલ
ચેરમેન
ક્રેડાઈ-સુરત



રવજીભાઈ પટેલ
પ્રમુખ
ક્રેડાઈ-સુરત



વિજય ધામેલિયા
માનદ્મંત્રી
ક્રેડાઈ-સુરત